

ફોજદારી પરચુરણ અરજ નં. ૩૩૬/૨૦૨૬

:- આંક - ૧ હેઠળ હુકમ :-

(૧) હાલની અરજી અરજદારે સી. આર. પી. સી. કલમ-૪૫૧ અને ૪૫૭/બી.એન.એસ.એસ. ૪૯૭ અને ૫૦૩ મુજબ ફોડની રકમ પરત મેળવવા માટે કરેલી છે. આ કામે કેસની ટુંકી હકિકત એવી છે કે અરજદારનાં HDFC BANK ના ખાતા નં.50100080750965 માંથી રૂ.૩૨,૧૦૦/- તથા તેમના બીજા ICICI BANK ના ખાતા નં.058401540837 માંથી રૂ.૩૨,૫૦૦/- ઉપડી ગયેલ હતા. જે રકમ સાયબર ફોડ દ્વારા સામાવાળાના નીચે જણાવેલ બેન્કોમાં ટ્રાન્સફર થયેલી.

અ.નં.	ખાતા ધારકનું નામ	ખાતા નંબર	બેંકનું નામ	રકમ
૧		602579653442	ICICI BANK	25925
૨		691123448586	CENTRAL BANK OF INDIA	3425
૩		893329691348	IDBI BANK	500
૪		042370499448	STATE BANK OF INDIA	2190
૫		KCCBW260272495 92	CATHOLIC SYRIAN BANK LTD.(CSB)	32500
			TOTAL AMOUNT	64540

જેથી અરજદારે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા સામાવાળાનાં ઉપરોક્ત બેંક ખાતા ફિઝ કરવામાં આવેલ છે અને તેમાં રહેલ રૂ.૬૪,૫૪૦/- ફિઝ કરવામાં આવેલ છે જે રકમ અરજદારે હાલની અરજી દ્વારા પરત માંગેલ છે. અરજી પરત્વે સંબંધિત પોલીસ સ્ટેશન પાસેથી રીપોર્ટ મંગાવતા હુકમ કરતા તે અવ્યયે સાઈબર ક્રાઇમ પોલીસ સ્ટેશન મરોલી દ્વારા તા.૦૪/૦૪/૨૦૨૬ ના રોજનો રીપોર્ટ અત્રેની કોર્ટમાં રજૂ કરેલ છે.

(૨) સાઈબર ક્ષાઈમ પોલીસ સ્ટેશન નવસારી ધ્વારા રજૂ રીપોર્ટ ધ્યાને લેતાં અરજદારનાં HDFC BANK ના ખાતા નં.50100080750965 માંથી રૂ.૩૨,૧૦૦/- તથા તેમના બીજા ICICI BANK ના ખાતા નં.058401540837 માંથી રૂ.૩૨,૫૦૦/- તા.૨૫/૦૧/૨૦૨૬ ના રોજ ઉપડી હતા. જે બાબતે અરજદારે સાયબર આસ્પસ્ત પ્રોજેક્ટમાં ૧૯૩૦ નંબર ઉપર કોલ કરી ફરીયાદ નોંધાવેલ હતી. જે ફરીયાદનો ટીકીટ નં. 31101260022093 આપવામાં આવેલ. ફરીયાદ આધારે સાયબર ક્ષાઈમ સેલ, સી.આઈ.ડી.ધ્વારા અરજદારના ઉપરોક્ત ખાતામાંથી ગયેલ નાણા પૈકી સામાવાળા શંકાસ્પદ બેંકની માહિતીનું પત્રક નીચે મુજબ છે.

અ.નં.	ખાતા ધારકનું નામ	ખાતા નંબર	બેંકનું નામ	રકમ
૧		602579653442	ICICI BANK	25925
૨		691123448586	CENTRAL BANK OF INDIA	3425
૩		893329691348	IDBI BANK	500
૪		042370499448	STATE BANK OF INDIA	2190
૫		KCCBW260272495 92	CATHOLIC SYRIAN BANK LTD.(CSB)	32500
			TOTAL AMOUNT	64540

જે અંગે સાયબર ક્ષાઈમ સેલ, સી.આઈ.ડી.ક્ષાઈમ બ્રાંચ, ગાંધીનગર, ગુજરાત રાજ્યનો અભિપ્રાય મંગાવતા તેઓએ અભિપ્રાય મોકલી આપેલ છે કે અરજદાર સાઈબર ક્ષાઈમનો ભોગ બનેલ હોય અને સામાવાળાના ઉપરોક્ત ખાતા ડ્રિઝ કરવામાં આવેલ છે અને તેમાં રહેલી અને ડ્રિઝ થયેલી રકમ અરજદારને સુપરત કરવામાં આવે તો વાંઘો નથી. વિશેષમાં ત.ક.અધિકારીએ જણાવેલ છે કે સામાવાળાનાં ખાતા બનાવટી હોવાનું જણાઈ આવે છે કારણ કે સદરહુ

ખાતા સીઝ કર્યા બાદ ખાતેદાર કે અન્ય કોઈ વ્યક્તિએ ખાતા સીઝ કર્યા બાબત પોલીસ સમક્ષ કોઈ વાંધા-તકરાર લીધેલ નથી. આમ, ત.ક.અધિકારીના અભિપ્રાયને ધ્યાને રાખતાં જે ખાતામાં ફ્રોડની રકમ ગયેલ છે તે ખાતા ફ્રિઝ કરવા છતાં તે અંગે કોઈ ખાતેદારે વાંધો ઉઠાવેલ નથી જે પરથી જણાય છે કે આ ખાતા ફ્રોડ કરવા માટે જ ખોલાવવામાં આવેલ હશે અને પોતાનું ફ્રોડ પકડાઈ ન જાય તે માટે ખાતા સીઝ કરવા છતાં ખાતેદારે પોલીસનો સંપર્ક કરેલ નથી જે પ્રથમદર્શનીય રીતે જણાય છે કે આ ખાતા ફ્રોડ માટે જ ઓપન કરવામાં આવેલ હશે જેથી આ ખાતામાં ફ્રિઝ થયેલી રકમ અરજદારના ખાતામાંથી ફ્રોડ ધ્વારા ટ્રાન્સફર થયેલ હોવાથી તે રકમ અરજદારના ખાતામાં પુનઃ ટ્રાન્સફર કરવી જરૂરી છે અને તે રકમ અરજદારને તે રીતે પરત કરવી ન્યાયી અને યોગ્ય જણાય છે જેથી આ અરજી હેઠળ નીચે મુજબનો હુકમ કરવામાં આવે છે.

હુકમ

૧. સામાવાળાના ઉપરોક્ત તમામ ખાતા સાચબર ક્લાઈમ ધ્વારા સીઝ કરી તેમાં રહેલ રકમ ફ્રિઝ કરવામાં આવેલ છે જે રૂ.૬૪,૫૪૦/- અરજદારનાં HDFC BANK ના ખાતા નં.50100080750965 માં ટ્રાન્સફર કરવા માટે અરજદારની બેંકને આદેશ કરવામાં આવે છે.

૨. સામાવાળાના ઉપરોક્ત તમામ ખાતા ફ્રિઝ કરેલ હોવાથી અરજદારના ખાતામાં ઉપરોક્ત રકમ ટ્રાન્સફર કરવા પુરતું આ ખાતા એક્ટીવ કરવા અને ઉપરોક્ત રકમ અરજદારના ખાતામાં ટ્રાન્સફર થઈ ગયા બાદ આ ખાતા કાયમી માટે ક્લોઝ કરવાનો આદેશ તપરોક્ત કોષ્ટકમાં જણાવેલ સામાવાળાની તમામ બેંકોને કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં આ ખાતા ધ્વારા અન્ય લોકોની સાથે ફ્રોડ કરવામાં આવે નહિ.

૩. આ હુકમની અમલવારી કરવા માટે સાચબર ક્લાઈમ, સી.આઈ.ડી.

બ્રાંચ, ગાંધીનગરનાઓએ અરજદાર તથા સામાવાળાની બેંક સાથે સંકલનમાં રહી હુકમની અમલવારી કરવી.

જ. હુકમની એક નકલ અરજદારને આઈ.ડી.કાર્ડ રજુ કર્યેથી સુપરત કરવી.

હુકમ આજરોજ તારીખ ૦૭ મી માહે એપ્રિલ સને ૨૦૨૬ ના રોજ ખુલ્લી અદાલતમાં વાંચી સંભળાવી મારી સહી કરીને જાહેર કર્યો.

તારીખ: ૦૭/૦૪/૨૦૨૬

(પ્રભાકર કૃષ્ણકાંત રાય)

નવસારી

એડીશનલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ, નવસારી

કોડ નં.-GJ-01112